



### માર્ચ 1 થી રસીકરણના પુરાવા, બ્રમ્પટનના રિક્કિએશન સેંટરોની અને પર્ફોર્મિંગ આર્ટ સ્થળોની ક્ષમતા મર્યાદાની જરૂરિયાતોને સિટી પાછી ખેંચશે

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 માર્ચ 2022) – માર્ચ 1 થી લાગુ, હવે પછી રસીકરણના પુરાવાની જરૂર રહેશે નહીં, અને બાકી રહેલી બ્રમ્પટનના રિક્કિએશન સેંટરોની અને પર્ફોર્મિંગ આર્ટના સ્થળોની ક્ષમતા મર્યાદાની જરૂરિયાતો પાછી ખેંચવામાં આવે છે. આ પગલાં, ઓન્ટારિયો સરકારની [ફેબ્રુઆરી 14](#) ની જાહેરાત બાદ અને પીલ પબ્લિક હેલ્થની માર્ગદર્શિકા હેઠળ લેવામાં આવ્યા છે.

જોકે જે લોકો બ્રમ્પટનના રિક્કિએશન સેંટરો અને પર્ફોર્મિંગ આર્ટના સ્થળોની મુલાકાત લેશે તેમણે હજુ પણ મકાનની અંદર બિન-તબીબી માસ્ક પહેરવાની જરૂર રહેશે અને ભૌતિક અંતર જાળવવાનું રહેશે. સિટીની સુવિધાઓમાં દાખલ થતા પહેલા રહેવાસીઓને જાણાવવામાં આવે છે કે COVID-19ના લક્ષણો છે કે કેમ તે અંગે જાતે તપાસ કરી લેવી અને તબિયત સારી નહીં હોય તો ઘરે જ રહેવું.

#### મનોરંજન

રિક્કિએશન સેંટરો રજિસ્ટર થયેલ અને ડ્રોપ-ઇન પ્રોગ્રામિંગ માટે ખુલ્લા છે. રિક્કિએશન સેંટરોની મુલાકાતો માટે પૂર્વ-રજિસ્ટ્રેશનની જરૂર નથી જોકે એવી ભલામણ કરવામાં આવે છે કે પોતાની મુલાકાત પહેલા ઓનલાઇન માધ્યમથી પોતાની સેવાઓ આગોતરી ખરીદી લે કારણકે તમામ સેવાઓ વહેલા તે પહેલાના ધોરણે રહેશે. ક્યા પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે તે બ્રાઉઝ કરવા અને રજિસ્ટર કરવા માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/registerforprograms](http://www.brampton.ca/registerforprograms) અથવા 311 પર કૉલ કરો કે કોઈપણ રિક્કિએશન સેંટર પર રૂબરૂ આવો.

#### પર્ફોર્મિંગ આર્ટ્સના સ્થળો

દરોજ સહિતના પર્ફોર્મિંગ આર્ટ્સના સ્થળો, તેની પૂર્ણ ક્ષમતા સાથે 01 માર્ચ 2022થી ફરી ખુલશે. [www.therosebrampton.ca](http://www.therosebrampton.ca) પર ટિકિટો ખરીદો અને વધુ જાણકારી મેળવો.

#### માસ્ક

રહેવાસીઓને સ્મૃતિ કરાવીએ છીએ કે સિટીએ તેના COVID-19ના ફરજિયાત ફેસ માસ્કના બાય-લૉને સિટીની તમામ સુવિધાઓ પર વિસ્તાર્યો છે.

ચહેરાનાં COVID-19 ફરજિયાત માસ્કના બાય લૉ હેઠળ બિન-તબીબી માસ્ક પહેરવા બ્રમ્પટન ખાતેની તમામ ઈન્ડોર

જગ્યાઓમાં આવશ્યકતા છે. સ્કાર્ફ, બન્ડાના, નેક ગેઈટર્સ અથવા નેક વોર્મરો અને ઉચ્છ્વાસના વાલ્વ ધરાવતા માસ્ક, ચહેરાના આવરણો તરીકે સ્વીકાર્ય નથી. તે ઉપરાંત બાય-લો હેઠળ, માસ્ક ફક્ત ત્યારે જ કાઢી શકાશે જો વ્યક્તિ ખાવા કે પીવાના હેતુથી કોઈ નિયુક્ત ફરેલ સ્થળ પર બેસીને તેમ કરતા હોય.

સિટી રહેવાસીઓનો આભાર માને છે કે તેઓ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, ભૌતિક અંતર જાળવી રહ્યા છે, સ્વચ્છતા જાળવે છે અને COVID-19 ને રોકવા માસ્ક પહેરી રહ્યા છે.

-30-

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)